

મર્ડરનો નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.

સુરત શહેર વિસ્તારમાં મિલકત તથા શરીર સંબધી ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ તેમજ એસ.ઓ.જી. ને લગતી કામગીરી અંગે તથા હોળી ધુળેટીના તહેવાર લગત શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે સારુ શહેર વિસ્તાર પોલીસ કમિશ્નરશ્રી સતીષ શર્મા સાહેબનાઓની સુચના મુજબ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા

આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર.ચૌધરી એસ.ઓ.જી સુરત શહેર પો.સ.ઈ. એ.પી.બ્રહ્મભટ્ટ એસ.ઓ.જી તથા પોલીસ માણસોની ટીમ સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન એસ.ઓ.જી.ના અ.પો.કો પ્રતિક લક્ષમણ તથા અ.પો.કો અશોક નારાયણ નાઓને અંગત બાતમીદાર મારફતે એવી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે લિમ્બાયત પોલીસ સ્ટેશનના ખુનનાં ગુનામાં પકડવાનો બાકી આરોપી નામે વિકાસસીંગ ઉર્ફે અંકુરનાઓ હાલમાં લિમ્બાયત ગોવિંદનગર રેલ્વે ગરનાળા સામે રોડની બાજુમાં ઉભેલ છે. જે બાતમી મળતા તેને પકડી પાડી નામ ઠામ પુછતા તેને પોતાનુ નામ વિકાસસીંગ ઉર્ફે અંકુરસીંગ સુરેશસીંગ જતે રાજપુત ઉ.વ.૨૧ ધંધો.નોકરી. રહે. પ્લોટ નં. ૪૦, તીરુપતી રો-હાઉસ દેલાડવા રોડ ખરવાસા ડીડોલી સુરત મુળગામ:- બાદશાપુરગામ ત.મછલી શહેર જી.જોનપુર ઉતરપ્રદેશનો હોવાનુ જણાવેલ, અને મળેલ બાતમી હકીકત બાબતે પુછપરછ કરતા પોતે તા.૧૯/૨/૨૦૧૭ ના રોજ શીવાજી મહારાજની જયતીના દિવસે મદનપુરા પ્લોટ નં ૧૫૬ ની સામે હાજર હતો તે વખતે ઝગડો થતા કાશીનાથ નામના માણસની સાથે બારકુ પાટીલ, સમાધાન ઉર્ફે લાડુ, રાહુલ, ચન્દ્રકાંત ઉર્ફે રવી પાટીલ, સુર્યવંશી નાઓનો ઝઘડો થયેલ જેમા સમાધાન ઉર્ફે લાડુ એ પોતાની પાસે ના ચપ્પુ કાશીનાથને મારેલ હતુ. અને સદરી ઈસમ સારવાર દરમિયાન મરણ ગયેલ.

આ ગુનાના કામે નાસતો ફરતો હોય તેને લિમ્બાયત પોલીસ સ્ટેશન I ૩૩/૨૦૧૭ I.P.C. કલમ ૩૦૭,૩૨૩,૧૪૧,૧૪૭,૧૪૮,૧૪૯,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના કામે પકડવાનો બાકી હોય જેને આજરોજ તા ૧૨/૩/૨૦૧૭ ના રોજ કલાક ૧૬/૩૦ વાગે પકડી પાડી અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે.